

Date: August 06, 2024

To, **BSE Limited** Phiroze Jeejeebhoy Towers Dalal Street, Kala Ghoda, Fort, Mumbai - 400 001

Security Code: 526544

Security ID: SCANPGEOM

ISIN:- INE967B01028

Dear Sir/ Madam,

Sub: Newspaper advertisement confirming dispatch of Postal Ballot Notice

Reference: - Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

In continuation to our letter dated August 05, 2024, regarding the postal ballot notice, please find enclosed the copies of the newspaper advertisement confirming dispatch of the notice.

The Advertisement appeared in Financial Express English and Gujarati.

Request you to kindly take the above on record and disseminate the same on your website.

For, Scanpoint Geomatics Limited

Kantilal Vrajlal Ladani Whole Time Director DIN:-00016171

Enclosed :- As Above



Regd. Office: 2nd Floor, Fermenter House, Alembic City, Alembic Avenue Road, Vadodara-390 003, Gujarat, India Web Site: www.godeepak.com, Investors Relation Contact: investor@godeepak.com Corporate Identification Number: L24110GJ1970PLC001735, Tel.: +91-265-2765200, Fax: +91-265-2765344

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30™ JUNE, 2024

| Sr. | Particulars | | Quarter Ended | | | | |
|-----|---|---------------------------|---------------------------|---------------------------|-------------------------|--|--|
| No. | | 30.06.2024 (Unaudited) | 31.03.2024 (Unaudited) | 30.06.2023 (Unaudited) | 31.03.2024 (Audited) | | |
| 1 | Total Income from Operations | 2,185.65 | 2,145.34 | 1,800.21 | 7,757.93 | | |
| 2 | Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items) | 274.80 | 349.19 | 201.73 | 1,101.72 | | |
| 3 | Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items) | 202.53 | 253.85 | 149.90 | 810.89 | | |
| 4 | Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)] | 202.09 | 253.17 | 149.54 | 808.94 | | |
| 5 | Equity Share Capital (Face Value of ₹2/- each) | 27.28 | 27.28 | 27.28 | 27.28 | | |
| 6 | Other Equity | NA | NA | NA | 4,769.34 | | |
| 7 | Earnings per share (Face Value of ₹2/- each) (not annualised) (for continuing and discontinued operations) | | | | | | |
| | 1. Basic | 14.85 | 18.61 | 10.99 | 59.45 | | |
| | 2. Diluted | 14.85 | 18.61 | 10.99 | 59.45 | | |
| Ext | ract from the Standalone Financial Results: | | | | ₹ in Crores | | |
| | | | | | | | |

| Sr. | | | Year Ended | | |
|-----|---|---------------------------|---------------------------|---------------------------|-------------------------|
| No. | Particulars Particulars | 30.06.2024 (Unaudited) | 31.03.2024 (Unaudited) | 30.06.2023 (Unaudited) | 31.03.2024 (Audited) |
| 1 | Total Income from Operations | 729.44 | 688.51 | 718.61 | 2,848.05 |
| 2 | Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items) | 85.03 | 156.72 | 115.21 | 558.26 |
| 3 | Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items) | 63.04 | 115.68 | 85.82 | 433.43 |
| 4 | Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)] | 62.60 | 115.29 | 85.46 | 431.77 |

Note:

Place : Vadodara

Date : August 05, 2024

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated financial results are available on stock exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on company's website (www.godeepak.com)

> For DEEPAK NITRITE LIMITED D. C. MEHTA

Chairman & Managing Director DIN: 00028377



INDRAPRASTHA MEDICAL CORPORATION LIMITED

Registered office: Sarita Vihar, Delhi Mathura Road, New Delhi - 110076
Corporate Identity Number: L24232DL1988PLC030958
Phone: 91-11-26925858, 26925801, Fax: 91-11-26823629 E-mail: imclshares@apollohospitalsdelhi.com, Website: delhi.apolloh

Extract of Statement of unaudited Financial Results for the Quarter ended 30th June, 2024

| _ | | Quarter ended | | | | |
|-----------|--|---|--------|--------|---------|--|
| S. No. | Particulars | Particulars 30.06.2024 31.03.2024 (Unaudited) (Audited) | | | | |
| 1 | Total income from operations (Net) | 352.98 | 319.62 | 310.07 | 1261.59 | |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 59.59 | 41.56 | 40.23 | 166.11 | |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 59.59 | 41.56 | 40.23 | 166.11 | |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 44.77 | 31.17 | 30.50 | 123.96 | |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after Tax)] | 46.75 | 32.13 | 30.16 | 125.81 | |
| 6 | Paid-up Equity share capital (Face value Rs. 10/- each) | 91.67 | 91.67 | 91.67 | 91.67 | |
| 7 | Reserves (excluding Revaluation Reserves) as shown in the audited balance sheet of previous year | | | | 386.09 | |
| 8 | Earnings per share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - Basic & Diluted | 4.88 | 3.40 | 3.33 | 13.52 | |

The above is an extract of the detailed format of unaudited financial results for the quarter ended 30th June, 2024, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results for the quarter ended 30th June, 2024, are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and on the company's website.

Shivakumar Pattabhirama Place : New Delhi (Managing Director) Date: 5th August, 2024 DIN: 08570283

SUN PHARMA ADVANCED RESEARCH COMPANY LIMITED

Regd. Office: Plot No. 5 & 6/1, Savli, G. I. D. C. Estate, Savli - Vadodara Highway, Manjusar, Vadodara – 391 775. Tel.: +91-2667 666800, CIN: L73100GJ2006PLC047837, Website: www.sparc.life



EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

| | | | | | ₹ in Lakhs | |
|-----|--|--------------|---------------|------------|------------|--|
| | | CONSOLIDATED | | | | |
| Sr. | Particulars | | Quarter ended | | Year ended | |
| No. | r ai iicuiai s | 30.06.2024 | 31.03.2024 | 30.06.2023 | 31.03.2024 | |
| | | Unaudited | Audited | Unaudited | Audited | |
| 1. | Total Income from Operations | 1,837 | 2,096 | 3,414 | 10,502 | |
| 2. | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items) | (9,550) | (10,541) | (9,535) | (38,683) | |
| 3. | Net Profit / (Loss) for the period (before Tax and / or Extraordinary Items) | (9,550) | (10,541) | (9,535) | (38,683) | |
| 4. | Net Profit / (Loss) for the period (after Tax and / or Extraordinary Items) | (9,590) | (10,579) | (9,535) | (38,721) | |
| 5. | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) | (9,585) | (10,661) | (9,501) | (38,701) | |
| | and Other Comprehensive Income (after tax) | | | | | |
| 6. | Paid up Equity Share Capital | 3,245 | 3,245 | 3,245 | 3,245 | |
| 7. | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet | | | | 9,330 | |
| 8. | Basic Earning / (Loss) Per Share (of ₹1 each) | (2.96) | (3.26) | (2.94) | (11.93) | |
| | (for continuing and discontinued operations)* | | | | | |
| 9. | Diluted Earning / (Loss) Per Share (of ₹ 1 each) | (2.96) | (3.26) | (2.94) | (11.93) | |
| | (for continuing and discontinued operations)* | | | | | |

* Actual for quarter, not annualised

| 5 | | | | ANDALONE | | | |
|-----|--|-------------------------|-----------------------|-------------------------|-----------------------|--|--|
| Sr. | Particulars Particulars | | Year ended | | | | |
| No. | r al liculais | 30.06.2024 Unaudited | 31.03.2024 Audited | 30.06.2023 Unaudited | 31.03.2024 Audited | | |
| 1. | Total Income from Operations | 1,837 | 2,096 | 3,414 | 10,502 | | |
| 2. | Net Profit / (Loss) for the period (before Tax and / or Extraordinary Items) | (9,684) | (10,669) | (9,535) | (38,811) | | |
| 3. | Net Profit / (Loss) for the period (after Tax and / or Extraordinary Items) | (9,684) | (10,669) | (9,535) | (38,811) | | |

Note

i) The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the these Financial Results for Quarter ended June 30, 2024 are available on the websites of the Stock Exchanges viz.www.bseindia.com, www.nseindia.com and of the Company viz. www.sparc.life

ii) There were no deviations in the utilisation of the funds raised through the Preferential Issue of warrants convertible into equity shares of the Company, from the objects as specified in the Notice of Extra-Ordinary General Meeting dated May 12, 2021.

For and on behalf of the Board Dilip S. Shanghvi

Mumbai, August 5, 2024

ક્લાસીક ફિલામેન્ટ્સ લીમીટેડ

રજી. ઓફિસઃ પ્લોટ નં.૧, પ્રિયંકા હાઉસ, ઉમિયાધામ રોડ, વરાછા, સુરત–૩૯૫૦૦૬. CIN L17114GJ1990PLC013667 I Tel :0261-2540570 email: classicfilaments@ymail.com, Website: www.classicfilamentsltd.com

૩૪મી વાર્ષિક સામાન્ય સભા, રીમોટ ઈ-વોટીંગ **अने जु**ङ ड्लोઝनी सुचना

આથી સૂચના આપવામાં આવે છે કે ક્લાસિક ફિલામેન્ટ્સ લિમિટેડની 34મી વાર્ષિક સામાન્ય સભા ("મીટિંગ") ગુરુવાર, 5મી સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11.00 કલાકે IST વિડિયો કોન્કરન્સિંગ ("VC")/ અન્ય ઑડિયો વિઝ્યુઅલ માધ્યમો ("OAVM" દ્વારા યોજાશે). જનરલ સરક્યુલર્સ તા. ૮મી એપ્રિલ ૨૦૨૦, તા. ૧૩ મી એપ્રિલ ૨૦૨૦, ૫ મે ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૧૪ ડિસેમ્બર ૨૦૨૧, ૫ મે ૨૦૨૨, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ અને અન્ય લાંગુ પડતા પરિપત્રો, જો કોઈ હશે તો જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ પરિપત્રો) દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા. તદુપરાંત ૧૨ મે ૨૦૨૦, જાન્યુઆરી ૧૫ ૨૦૨૧, મે ૧૩ ૨૦૨૨, જાન્યુઆરી ૦૫ ૨૦૨૩,ઓક્ટોબર ૦૭ ૨૦૨૩ અને અન્ય લાગુ પડતા પરિપત્રો જે સિક્યુરિટિસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી સર્ક્યુલર) જેના હેઠળ કંપનીઓને સભ્યોની એક જ જગ્યાએ રૂબરૂ હાજરી વિના પણ વીસી / એવીએમ દ્વારા એજીએમ યોજવા માટે અધિકૃત કરવામાં આવી છે. ઉપરોક્ત પરિપત્રો દ્વારા પ્રાપ્ત અધિકારોની રૂએ સદર એજીએમ વીસી / ઓએવીએમ મારફત નોટિસ માં દર્શાવેલ ઠરાવ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે.

ઉપરોક્ત પરિપત્રોના પાલનમાં, એજીએમની નોટિસ અને નાણાકીય વર્ષ 2023-24 માટેના વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નંકલો એવા તમામ શેરધારકોને મોકલવામાં આવી હતી જેમના ઈમેલ એડ્રેસ કંપની/ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે. શેરધારકોને વાર્ષિક અહેવાલની ઈલેક્ટ્રોનિક ડિસ્પેય 5મી ઓગસ્ટ,2024ના રોજ પૂર્ણ થઈ ગઈ છે.વાર્ષિક અહેવાલ સિંદતની એજીએમની સૂચના કંપનીની વેબસાઈટ www.classicfilamentsltd.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

કટ ઓફ તા.૨૯ મી ઓગસ્ટ, 2024 ના રોજ સ્થિતિ મુજબ ભૌતિક અથવા ડીમટેરીલાઈઝ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો ઠરાવમાં પ્રસ્તાવિત મુદ્દાઓ પર એનએસડીએલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર ઇલેક્ટ્રોનિકલી વોટિંગ, એજીએમ (રિમોટ ઈ-વોટિંગ) દ્વારા વોટિંગ ના નિર્ધારિત સ્થળ સિવાય અન્ય સ્થળ પરથી પર્ણ સભ્યો ઈ-વોટિંગ કરી શકે છે.

તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે:

- ા રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો સોમવાર,2જી સપ્ટેમ્બર,2024ના રોજ IST સવારે 9:00 વાગ્યે શરૂ થાય છે.
- ii. રિમોટ ઈ-વોટિંગ સમયગાળો બુધવાર,4 સપ્ટેમ્બર,2024 ના રોજ સાંજે 5:00 વાગ્યે IST પર સમાપ્ત થશે.
- iii ઇલેક્ટ્રોનિક માધ્યમથી અથવા એજીએમમાં મતદાન કરવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ ગુરુવાર,29મી ઓગસ્ટ,2024 છે.
- iv ૪થી સપ્ટેમ્બર, 2024 ના રોજ IST સાંજે 5.00 P.M પછી ઇ-વોટિંગની મંજૂરી
- આપવામાં આવશે નહીં. v. ત્યારબાદ મતદાન માટે NSDL દ્વારા ઈ-વોટિંગ મોડ્યુલ અક્ષમ કરવામાં આવશે.
- એકવાર ઠરાવ પર સભ્યો દ્વારા મત આપવામાં આવે, તે પછીથી બદલી શકાશે નહીં. vi નોટિસ એવા સભ્યોને ઈમેલ કરવામાં આવે છે,જેમના નામ સભ્યોના
- રજિસ્ટર/લાભકારી માલિકોની યાદીમાં શકવાર.2જી ઓગસ્ટ.2024ના રોજ દેખાય છે.જે સભ્યોએ નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખ એટલે કે ગુરુવારે 29મી ઓગસ્ટ 2024 તારીખ પહેલાં શેર હસ્તગત કર્યા છે તેઓ evoting@nsdl.co.in અથવા
- admind@skylinerta.com અને contact@skylinerta.com / classicfilaments@ymail.com પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને પાસવર્ડ vi જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ
- એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદાર viii મીટિંગ દરમિયાન મતદાન માટેની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે અને એજીએમમાં હાજર
- રહેલા સભ્યો કે જેમણે રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી તેઓ એજીએમમાં ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા તેમના મતનો ઉપયોગ કરી શકશે. ix ડીમટીરિયલાઈઝ્ડ મોડ,ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે અને જે સભ્યોએ તેમના ઈમેલ એડ્રેસની નોંધણી કરાવી નથી તેમના માટે રિમોટ ઈ-વોટિંગની રીત એજીએમની સૂચનામાં આપવામાં આવી છે.જે સભ્યોએ હજુ સુધી તેમના ઈમેલ એફેસની નોંધણી કરાવી નથી તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એજીએમની

.. સૂચનામાં દર્શાવેલ પ્રક્રિયાને અનુસરે અને ઈ-વોટિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ

x જો શેરધારકો/સભ્યોને ઈ-વોટિંગ અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQs") અને ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી પર કૉલ કરી શકો છો.નંબર:1800-222-990.

આથી સૂચના પણ આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, 2013 ની કલમ 91 અનુસાર કંપનીઝ (મૈનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, 2014 ના નિયમ 10 અને સેબીના નિયમન 42 (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, 2015 સાથે વાંચતા એજીએમના હેતુ માટે કંપનીના સભ્યો અને શેર ટ્રાન્સફર બુક્સ ગુરુવાર,29મી ઓગસ્ટ, 2024 થી ગુરુવાર,5મી સપ્ટેમ્બર,2024 (બંને દિવસો સહિત) સુધી બંધ રહેશે.

ક્લાસીક ફિલામેન્ટ્સ લિમીટેડ સહી/– જચંતિ ગૌદાણી મેનેજિંગ ડાયરેક્ટર સ્થળઃ સુરત તારીખઃ ૦૬–૦૮–૨૦૨૪ DIN- 03571671

સ્કેનપોઈન્ટ જીઓમેટિક્સ લિમિટેડ

CIN:L22219GJ1992PLC017073 ૨જી.ઓફ્સિ:ડી-૧૦૧૬-૧૦૨૧,૧૦મો માળ, સ્વાતી ક્લોવર,શીલજ સર્કલ,એસ.પી.ટીંગ રોડ,શીલજ,દશ્ક્રોઈ,અમદાવાદ-૩૮૦૦૫૯ ફોન:o૭૯-૪૬૦૨૩૯૧૨ | ઇમેઇલ: cs@sgligis.com | વેબ: www.sgligis.com

ટપાલ મતદાનની નોટિસ

સભ્યોને આ રીતે જાણ કરવામાં આવે છે કે કંપની અદિનિયમ ૨૦૧૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ તથા અન્થ લાગુ ૫ડતા પ્રવિદ્યાનો અનુસા૨ (જેમને "અદ્યિનિચમ" તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.) તથા કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિચમો ૨૦૧૪ તેમ૧ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સામાન્થ પરિપત્રો (જેમને "MCA પરિપત્રો" તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. અને સિક્ચોરીટીઝ એન્ડ એક્સરોન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિઝક્લોઝર વિક્વાચરમેન્ટ્સ) નિચમન ૨૦૧૫ તથા કોઈ પણ અન્ય લાગુ પડતા કાયદા, નિચમો અને નિચમન (તેમના વિદાયેક સુધારા/પુન બારંભ સમય માટે) સાથે વાંચીને સ્કેનપોઈન્ટ જાઓમેટિક્સ લિમિટેડ (કંપની)ના સભ્યોની મંજૂરી નીચેના સામાન્ય અને વિશેષ ઠરાવ ગણક) દ્વારા માગવામાં આવે છે.

| ક્રમ સંખ્યા | વ્યવસાય | સામાન્ય/વિશેષ ઠરાવ |
|----------------|--|-----------------------|
| ۹. | કંપનીની અનુમોદિત શેર મૂડીમાં વધારો અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના મૂડી ક્લોઝમાં ફેસ્ફાર | સામાન્થ |
| ૨. | શ્રીમતી સીમા ચંદ્રેશ વિથલાની (DIN:- 06921003) ની કંપનીના સ્વતંત્ર મહિલા ડિરેક્ટર તરીકે નિમણૂક | વિશેષ |
| 3. | કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના ઓબ્જેક્ટ ક્લોઝમાં સુધાર | વિશેષ |
| ٧. | રકેન પોઈન્ટ જાઓમેટિક્સ લિમિટેડનું નામ બદલીને SGL રિસોર્સસ લિમિટેડ કરવા માટે મંજૂરી | વિશેષ |

MCA પરિપત્રો અનુસાર, કંપનીએ ટપાલ મતદાનની નોટિસની ઇલેક્ટ્રોનિક નક્લો સાથે સ્પષ્ટીક્ર્સ નિવેદન ૫ ઓગસ્ટ ૨૦૨૪, સોમવારે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તે સભ્યોને મોક્લી છે જેમની ઈમેલ સરનામ ૨ ઓગસ્ટ ૨૦૨૪ (કટ-ઓફ તારીખ) ના રોવ કંપની/ડિપોઝિટરી ભાગીદાર સાથે નોંધાચેલા છે.

વધુમાં, નોટિસ કંપનીની વેબસાઈટ www.sgligis.com પર ઉપલબ્ધ છે અને BSE લિમિટેડ ("BSE") ની વેબસાઈટ www.bseindia.com. ના સંબંધિત વિભાગમાં અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("NSDL") ની વેબસાઈટ www.evoting.nsdl.com**୳૨ ଏହା ଓଏଙ୍କ છે.**

MCA પરિપત્રો મુજબ સભ્યો ફક્ત ઈ-મત જ મત આપી શકે છે. સભ્યોની મતાધિકારો કટ ઓફ તારીખના રોજ તેમના દ્વારા ધરાવેલી કંપનીના ઇક્લિયે શેર પર આધારિત ગણાશે જે કોઈ વ્યક્તિ કટ-ઓફ તારીખે કંપનીનો શેર ધારક ન હોય તેવા લોકો ટપાલ મતદાનન નોટિસને માત્ર જાણકારી માટે મની શકે.

કંપનીએ તમામ સભ્યોને ઈ-મત આપવાની સુવિદા પૂરી પાડવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("NSDL") ની સેવાઓનો ઉપયોગ કર્યો છે. ઈ-મતેની સુવિદા નીચે દર્શાવેલ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે:

ઈ-મતનો સમચગાળો પ્રારંભ : મંગળવાર, દુ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે

સમાપ્તિ : બુધવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સાંજના ૫:૦૦ વાગ્ચે કટ- ઓક તરીખઃ શક્રવાર. ૨ ઓગસ્ટ ૨૦૨૪

NSDL દ્વારા રીમોટ ઈ-મત બાદમાં તરત જ બંધ કરી દેવામાં આવશે અને તે આપવાન

સમચ પૂર્ણ થયા પછી મંજૂરી આપવી નહીં. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શ્રી અંકિત ઠકરાર (મેમ્બરશીપ નં. F11762, COP

નં.16611) ને સ્કૂરિનાઈઝર તરીકે નિમવામાં આવ્યા છે જેમણે ઈ-મત પ્રક્રિચાને ન્થાયી અને પારદર્શક રીતે નિરીક્ષણ કરવાનું છે. સ્કુરિનાઈઝર તેમના નિરીક્ષણના અહેવાલને કંપની સચિવને પ્રદાન કરશે. ઈ-મતના પરિણામો શુક્રવાર, દ્ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ અથવા પહેલા જાહેર કરવામાં આવશે અને કંપનીની વેબસાઈટ www.sgligis.com પર ਮદર્શિત કરવામાં આવશે અને BSE લિમિટેડની વેબસાઈટ www.bseindia.com. ਪਰ પણ જાણ કરવામાં આવશે

કોઈ પણ પ્રશ્નોની સ્થિતિમાં, તમે www.evoting.nsdl.comના ડાઉનલોડ વિભાગમ એરદારકો માટેની વારંવાર પૂછાતા પ્રશ્નો (FAOS) અને ચેરદારકો માટેની વારંવાર પૂછાતા પ્રશ્નો (FAOS) અને ચેરદારકો માટેની ઈ-મત વપરાશકર્તા માર્ગદર્શિકા જુઓ અથવા ૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ પર કોલ કરો અથવા evoting@nsdl.com પર વિનંતી મોક્લો. ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મતદાનની સુવિધા સાથે સંબંધિત તમામ ફરિયાદો માટે મિર પલ્લવી મહાત્રે, સીનીયર મેનેજર, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડને

evoting@nsdl.com પર ઈમેલ દ્વારા અથવા ૦૨૨-૨૪૯૯૪૮૯૦ પર સંપર્ક કરી શકો છો.

તારીખઃ ઓગસ્ટ ૫, ૨૦૨૪

સ્કેનપોઈન્ટ જીઓમેટિક્સ લિમિટેડ કોમલ પેશ્વાણી કંપની સચિવ અને કંપ્લાયન્સ ઓફિસર મેમ્બરશીપ નં.A63874

SAYAJI HOTELS LIMITED

CIN: L51100TN1982PLC124332

Regd. Office: F1, C3 Sivavel Apartment, 2, Alagappa Nagar, Zamin Pallavaram, Keelakattalai, Kanchipuram, Tambaram, Chennai, TN 600117 IN Tel. No.: 044-29871174 | Email Id: cs@sayajigroup.com | Website: www.sayajihotels.com

Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended on 30th June, 2024 (₹ in Lakhs except figures of EPS)

| | | | Standalone | | | Consolidated | | |
|-----------|--|---|-------------------------|----------------|---|---|---------------------------------------|--|
| S. No. | Particulars | Quarter Ended 30.06.2024 (Reviewed) | 30.06.2024 30.06.2023 3 | | Quarter Ended 30.06.2024 (Reviewed) | Quarter Ended 30.06.2023 (Reviewed) | Year Ended 31.03.2024 (Audited) | |
| 1 | Total Income from Operation (Net) | 2,885.12 | 2,530.59 | 11,646.28 | 2,889.29 | 2,534.98 | 11,662.40 | |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) | 393.03 | 373.46 | 2,306.05 | 396.76 | 376.83 | 2,320.07 | |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) | 393.03 | 373.46 | 2,306.05 | 396.76 | 376.83 | 2,320.07 | |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items) | 268.18 | 277.02 | 1,821.41 | 126.64 | 151.20 | 1,433.66 | |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 260.28 | 276.69 | 1,789.84 | 108.46 | 158.79 | 1,375.36 | |
| 6 | Equity Share Capital | 1,751.80 | 1,751.80 | 1,751.80 | 1,751.80 | 1,751.80 | 1,751.80 | |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | - | - | - | - | - | - | |
| 8 | Earnings Per Share (of ₹ 10/- each) Basic : Diluted : | 1.53 1.53 | 1.44 1.44 | 10.40 10.40 | 0.72 0.72 | 0.69 0.69 | 8.18 8.18 | |

 a. The above is an extract of the detailed format of the Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange website at (www.bseindia.com) and Company's website at (www.sayajihotels.com). Date : 05.08.2024

By the Order of the Board For Sayaji Hotels Limited Sd/-Abhay Chintaman Chaudhar

| (A) COL Housing | The contract of the contract o |
|---------------------------|--|
| (Չ) բոԵ Housing | સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ |
| Finance Limited | |
| Ghar Ki Baat | રજીસ્ટર્ડ ઓફીસ : લ્મો માળ, અંતરીસ ભવન, ૨૨ કરતુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી-૧૧૦૦૦૧, ફોન : ૦૧૧–૨૩૩૫૭૧૭૧, ૨૩૩૫૭૧૭૨, ૨૩૭૦૫૪૧૪, વેળસાઇટ : www.pnbhousing.com |
| ยแก | ના ઓફીસ : ઓફીસ નં. ૨૦૬–એ અને બી, બીજો માળ, ત્રિવિદ્ય ચેમ્બર, ફાચર સ્ટેશન સામે, ૠષભ પેટ્રોલ પંપ પાસે, રિંગ રોડ, સુરત–૩૯૫૦૦૩ |
| આગી ભાગ સ્ટીને સોલય લું એ | । मां लगातेल हेताहा२(२)) अने लगीनहा२(२)) अने लहेर लनतने नोरीस आगतामां आते छे है. नीर्ग होतम नं डीमां लगतिव स्थातर मिलहन (तो) सिस्सोर्ड विभागने जीरी(शार्ल्ड हराशेल छे लेनो |

આથી ખાસ કરીને કોલમ નં. એ માં જણાવેલ દેવાદાર(રો) અને જમેનદાર(રો) અને જહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે કોલમ નં. ડીમાં જણાવેલ સ્થાવર મિલકત (તો) સિક્ચોર્ડ લેણદારને ગીરો/ચાર્જડ કરાયેલ છે, જેને પ્રત્યક્ષ્મ(પરોસ કબજો (અહી કોલમ નં. સી મા જણાવ્યા મુંજબ) મેસ**સે પીએનબી હાઉસેંગ કાચનાન્સ લીમોર્ટેડ (પીએનબીએચએફએલ)** / સિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, "જે**નું જ્યાં છે, જે એ એ જે મ**છે" ન **હોરણે** નીચે જણાવેલ વિગતો મુજબ વેચાણ કરવામાં આવશે. આશ્રી અહી નીચે કોલમ નં. એ માં જણાવેલ દેવાદાર(રો)/ગીરવેદાર(રો)/ લાગતા વળગતા વેદાદાર(રો)/રોરવેદાર(રો) (બગતાન પછી) કાનુની વારસદાર), કાનુની પ્રતિલિધએ (જાણમાં હોય તેવા, જાણમાં ન હોય તેવા), એકમીન્સ્ટ્રટર(રો), એકમિન્સ્ટ્રેટર(રો), વારસદાર(રો), અસાબનીઓ) ને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એનફોર્સમેન્ટ નિચમો, ૨૦૦૨ ના નિચમ –૮(૬) અને દ સુધારા મુજબ નોટીસ આપવામાં આવે છે. વેચાણની વિગતવાર શરતો અને નિચમો માટે **મેસર્સ પીએનબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેક /** સિક્ચોર્ડ લેણદારની વેબસાઇટ એટલે કે www.pnbhousing.com પર આપેલ લિંક જોવા વિન્તી છે.

| લોન નંબર, દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર(રો)/ કાનુની વારસદાર (એ) | માંગણા રકમ અને તારીખ (બી) | (સી) પ્રકાર (સી) | ગીરો મિલકતની વિગત (કી) | રિઝર્વ સ્ક્રમ (આરપી) (ઇ) | ઇએમડી (૧૦ ટકા આરપી) (એફ) | બિડ જમા કરવાની છેલી તારીખ (જી) | | નિરિક્ષણની તારીખ અને સમય (આઇ) | જાણમાં હોય તેવા બોજા / કોર્ટ કેસ જો કોઇ હોય તો (કે) | |
|--|---|------------------------|---|--------------------------------|--------------------------------|--------------------------------------|-----------------|--|---|--|
| HOU/SRT/0818/569979 શાખા : સુરત / હેમંતકુમાર દેસાઇ /હેતલબેન હેમંતકુમાર દેસાઇ / પારીજાત ફેશન | ૧૬.૧૧.૨૦૨૨ નાં રોજ રૂા. ૩૦૮૪ <i>૭</i> ૯૨. <i>૭૬/</i> – | (ભૌત્તિક કબજો) | ફલેટ નં. ૫૦૪, પાંચમો માળ, એ ટાઇપ બિલ્ડીંગ, પૈકી એર્ડ વિંગ, સાંઇ વિલા, ડોક્ટર પાર્ક રોડ, જહાંગીસળાદ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૯ | ₹I. ₹3€0000/- | ₹I. ₹3€000/- | 8505.20.05 | રૂા. ૧૦૦૦૦/- | ૦૫.૦૮.૨૦૨૪ બપોરે ૧૨.૦૦ થી ૦૪.૦૦ કલાકે | **નથી/ જાણમાં નથી | |
| HOU/SRT/0319/666489 શાખા : સુરત / હિરેન રાજુભાઇ કુંભારે / મંગળાબેન કુંભારે | 3૧.૦૩.૨૦૨૧ નાં રોજ રૂા. ૧૬૮૦૮૯૧.૫૦/ - | (ભૌત્તિક કબજો) | ochis નં એ-3-30x, ગીંબેમાળા, કરોટ ને એ-3-30x, સાંઘપુંબન ટેસિડેન્સી, સાંઘ પુંબન ટેસિડેન્સી, સાંદિ નગાર ટેસિડેન્સી, સ્મહિલે એન્ક્ટોલ સાથે, નીલાગીરી-ગોડાદરા રોડ, લિંબાયત-ક્રિડોલી, એકપી નં. ૫૭/બી, ક્રિડોલી, રેવાન્યુ સર્વે નં. ૩૨૦/પૈલી, ochis નં. ૪૭૫, ટીપી સ્ક્રીમ નં. ૪૦, ઓપી નં. ૫૭, સુરત, ગુજરાત-3૬૪૨૧૦ | ₹ 1. | 443800/- | 8505.20.0 <i>5</i> | ₹I. 90000/- | ૦૬.૦૮.૨૦૨૪ બપોરે ૧૨.૦૦ થી ૦૪.૦૦ કલાકે | **નશી/ જાણમાં નથી | |

તેના પરના ૧૮ ટકા દરે લાગુ ચડત વ્યાજ તેમજ ચુકવાશી અને/અથવા વસુવાતની તારીખ સુધી લાગુ આકસ્મિક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વગેરે સહીત** પીએનબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ ાણકારી અને માહિતી હેઠળ ઉપર જણાવેલ સ્થાવર મિલકત/સિક્ચોર્ડ મિલકતો પર કોલમ નં. કે માં જણાવેલ સિવાય કોઇ બોજો/ દાવો નથી. આવા અન્ય બોજાઓ સફળ ખરીદાર/બીડરે ભરવાના/ચુકવવાના રહેશે. ભાવી ખરીદાર(રો)/ બીડરોને જણાવેલ બોજાઓની સચ્ચાઇની ખાતરી તેમની જાતે કરી લેવા વિનંતી છે.

. આજ દિન સુધી ઉપરોક્ત સ્થાવર મિલકતો / સિક્ચોર્ડ એસેટોના વેચાણ,તબદીલી અને / અથવા નિકાવથી પીએનબીએચએફએલના અધિકૃત અધિકારી / પીએનબીએચએફએલને કોર્ટનો પ્રતિબંધ અને / અથવા મના હુંકમ નથી.ર.ભાવી ખરીદાર/ બીડર અને રસ ધરાવતી વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે પસાર કરાયેલ પ્રક્રિયાઓ/આદેશની દવીલોનું નિરિસણ કરી શકે છે, જો કોઇ હોય તો જે કોતમ નં. કે માં જણાવેલ છે, જેમાં પીએનબીએચએ ફર્ઝો પાસે ઉપલબ્ધ ટાઇટલના દસ્તાવેજો તેમજ અન્ય વિગતોનો સમાવેશ થાય છે અને ટેન્ડર / બીડ અરજીઓ સુપરત કરતા પહેલા અથવા ઓફર કરતા પહેલા તમામ પાંસાઓથી તેમની જાતને માહિતગાર કરી શકે છે. બીડરોર્ચ આ હરાજીની શરતો અને નિયમો તેમજ બીડ ફોર્મમાં સહી કરવી પડશે. 3. નોંધ લેવી કે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોસેમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ (૩) મુજબ, બીડર(૨) / ખરીદાર વેચાણ કિમેતની ૨૫ ટકા (અનેંસ મની ડિપોઝીટ, જો કોઇ હોય તો, તેના સહીત) રકમ તેજદિવસે અથવા તેના આગામી દિવસે જમા કરવા કાનુન બંધાયેલ છે. વેચાણ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોસેમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯(૨) મુજબ સિક્યોર્ડ લેણદારને વેચાણ કિમતની ૨૫ ટકા રકમ મળ્યા પછી ફક્ત બીડર(રો) ની તરફેણમાં કરવામાં આવશે. વેચાણ કિંમતની બાકીની ૭૫ ટકા રકમ ખીદારે વેચાણની મંજુરીનો પત્ર મળ્યાની તારીખથી ૧૫ દિવસની અંદર ખરીદારે જમા કરવાન રહેશે, જેમાં ક્યુરના કિરસામાં મિલકત (સિક્ચોર્ડ એસેટનું કરી વેચાણ કરવામાં આવશે. ૪. મેસર્સ સી ૧ ઇન્ડિચા પ્રાઇવેટ લીમીટેડ ઇન્ડરાજી મારફત વેચાણ કરવામાં અધિકૃત અધિકારીને મદદ કરશે જે તેની કોર્પોરેટ ઓફીર પ્લોટ નં. ૬૮ ૩જો માળ, સેક્ટર ૪૪, ગુરગાઁવ, હારિયાણા, ૧૨૨૦૦૩ ખાતે ધરાવે છે. વેબસાઇટ www.bankeauctions.co મિલકતના નિરિક્ષણને સંબંધિત કોઇપણ સહ્યય માટે અથવા બીડ દસ્તાવેજો મેળવવા માટે અને કોદ sing.com અને અધિકૃત અધિકારી/સિક્ચોર્ડ લેણદારના વ્યક્તિનો સંપર્ક કરવો અથ અન્ય પુછપરછ અથવા રજીરટ્રેશન માટે, તમે મનોજકુમાર સોલંકી, સંપર્ક નં. ૧૮૦૦૧૨૦ ૮૮૦૦, ઇમેઇલ : auction@pnbi www.pnbhousing.com ની જોઇ શકો છો.

સહી/– અધિકૃત અધિકારી, મેસર્સ પીએનબી હાઉસિંગ કાચનાન્સ લીમીટેડ સ્થળ : સુરત, તારીખ : ૦૫–૦૮–૨૦૨૪

The Indian Express. For the Indian Intelligent.



I arrive at a conclusion not an assumption.

Inform your opinion detailed analysis.

indianexpress.com



REGIONAL OFFICE, LAL DARWAJA, AHMEDABAD-380 001

indianexpress.com

I arrive at a conclusion

not an assumption.

Inform your opinion with

detailed analysis.

♦ The Indian **EXPRESS**

JOURNALISM OF COURAGE —

APPENDIX-IV [Rule-8(1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas The undersigned being the authorized officer of the Central Bank of India, Vasana Branch, Lilanchal near Khoja's Bhattha Sarkhej Road, Vasna, Ahmedabad under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 08/07/2023 calling upon the borrower 1) M/S. JAI AMBE PRODUCTS (BORROWER) 2) MRS. SEEMA MAHESHKUMAR CHANCHLANI (Proprietor, Guarantor/Mortgagor) to repay the amount mentioned in the notice being Rs. 62,57,693/- (In Words Rupees Sixty Two Lakh Fifty Seven Six Hundred Ninety Three Only) is due to us as on 08/07/2023 with interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.

The Borrower/ Partners having failed to repay the amount, notice is hereby given to them and the public in general that the undersigned has taken PHYSICAL POSSESSION of the property described herein below in exercise of powers conferred on her under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 in compliance of the order dated 06/05/2024 passed by the Honble Chief Judicial Magistrate, Ahmedabad in CRMA No. 3365/2024 under Sec. 14 of the said Act on this 04th day of August

The borrower/Partners in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 62,57,693/- (In Words Rupees Sixty Two Lakh Fifty Seven Six Hundred Ninety Three Only) is due to us as on 08/07/2023 and further interest

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Equitable Mortgage of Property consisting of plot of land and tenement residential house in the name of Mrs. Seema Maheshkumar Chanchlani, admeasuring area about 149.35 Sq. Mts Together with construction standing thereon situated and lying in freehold N.A. Land bearing City Survey No. 10039 Paiki Plot No. 261 paiki admeasuring about 60.02 Sq. Yards i.e. 50.33 sq. Mtr. + City Survey No. 10040 Paiki Plot NO. 262 Piki admeasuring about 78.96 Sq. Mtr. + City Survey No. 10041 paiki Plot No. 263 paiki admeasuring about 20.06 Sq. mtr of Mouje ward Sardarnagar, Taluka: Ashrwa (Old Taluka City) Dist: Ahmedabad in Registration Sub -District: Ahmedabad - 06 (Naroda)State of Gujarat. Bounded by: East: Internal Road, West: Plot No. 264, North : Plot No. 262, South : Society Internal Road.

Place - Ahmedabad Central Bank of India केनरा बँक 🛆 Canara Bank

Fertigase Syndicate

Canara Bank - Anjar Branch : Plot No. 628, Ring Road, Anjar, Dist. Kutch, Gujarat - 370 110

SYMBOLIC POSSESSION NOTICE

Whereas The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 24.05.2023 calling upon the Borrower Mrs. Rajkumari Pandey (Borrower) and Mr. Ashish Pandey (Co-Borrower) to repay the amount mentioned in the notice, as on 24.05.2024 being Rs. 6,48,370.33 /- (Rupees Six Lakh Forty Eight Thousand Three Hundred Seventy and Thirty Three Paisa Only) plus further Interest and charges thereon from 25.05.2024 in the Housing Loan, within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 02nd day of August of the year 2024.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the Public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Anjar Branch on 24.05.2024, amounts to Rs. 6,48,370.33 /-(Rupees Six Lakh Forty Eight Thousand Three Hundred Seventy and Thirty Three Paisa Only) plus further Interest and charges thereon from 25.05.2024 in the Housing

Description of the Immovable Property

All the Piece and Parcel of Land and Buildings existing and/or to be constructed thereon on Plot No. 19, Survey No. 506/2, Village : Varsamedi, Taluka : Anjar, District : Kachchh, Area of Plot - 63.36 Sq. Mtrs.

Boundaries North: By Common Plot No. 3 East: By Plot No. 20

South: By 9.00 Mtrs. road

Date: 02.08.2024, Place: Anjar Authorised Officer, Canara Bank

वैंक ऑफ़ इंडिया Bank of India POSSESSION NOTICE (For Immovable Property)

Pethapur Branch: Shiv Shakti Avenue,

Whereas. The undersigned being the authorized officer of the Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest. Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 28-05-2024 calling upon the Borrower, Mohsin Yusufbhai Shaikh, Borrower and Mortgagor, Asalam Yusufbhai Shaikh, and Borrower and Mortgagor Yusuf Imamudeen Shaikh to repay the

paisa) within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this

amount mentioned in the notice being Rs.26,87,232.19 + Uncharged Interest (in words

Rs. Twenty Six Lakhs Eighty Seven Thousand Two Hundred and Thirty Two and Nineteen

the 3rd day of August of 2024. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the BANK OF INDIA, Pethapur Branch for an amount Rs. 26.87,232,19 and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

(a) Property No. 786 (old 779), CS No. 516 of sheet no. 18, Pethapur, Gandhinagar -382421 owned by SHAIKH YUSUFBHAI IMAMUDEEN in favour of bank of India, Pethapur branch which is more particularly described below:

"All the places and parcel of immovable property being land and building, present and future, situated at Property No. 786 (old 779), CS No. 516 of sheet no 18, N.A land bearing block/survey no 516, Land Area 50.53 Sq. Mtrs (81.18 Sq. Mtrs on site), GF-67.47 Sq. mt., FF - 67.47 sq mtrs (81.18 Sq. mt each i.e. 162.36 Sq.mt.), , Mouje Pethapur, Dist. Gandhinagar in the state of Gujarat within the jurisdiction of Sub-registrar Gandhinagar, together with the Buildings, Sheds, standing thereon" bounded as under:-East: Margin space, West: Road of Mohala, North: Land of keshavlal babulal, South: Land of Umedram Karmachand.

(b) Property No. 248 (old 779), CS No. 670 of sheet no. 18, Pethapur, Gandhinagar -382421 owned by SHAIKH ASLAMBHAI YUSUFBHAI in favour of bank of India, Pethapur branch which is more particularly described below:

"All the places and parcel of immovable property being Land and building, present and future, situated at Property No. 248 (old 779), Cs No. 670 of sheet no. 18, N.A land bearing Block/survey no. 670, land Area 47.79 Sq. Mtrs (60.48 Sq.mt on site), Construction GF & FF, Sf 112.89 Sq. mts., Mouje Pethapur, Dist. Gandhinagar in the state of Gujarat within the jurisdiction of sub-registrar Gandhinagar, together with the Buildings, sheds, standing thereon" bounded as under:- East: Road, West: Road, North: Road. Right to put a window, South: Property of Shah Ambalal Ramnilal

(c) Property No. 786/1 or previously 789 (old 585/B), CS No - 515 of sheet no. 18, Pethapur, Gandhinagar - 382421 owned by SHAIKH YUSUFBHAI IMAMMUDEEN in favour of Bank of India, Pethapur Branch.

"All the places and parcel of immovable property being Land and Building, present and future, situated at Property No. 789 (old 585/B), CS no - 515 of sheet no 18, N .A land bearing Block/survey no. 670, land area 67 sq mtrs (78.74 sq mt on site), construction GF - 42 sq mt & FF - 42 sq mtrs ie 84 sq mtrs (GF - 78.74 sq mt FF - 78.74 sq m tie 157.48 sq mt as open site), mouje Pethapur, Dist - Gandhinagar in the state of Gujarat within the jurisdiction of Sub-Registrar, Gandhinagar, together with the Buildings, Sheds, Standing thereon * bounded as under - East: open land, West: Wall of Jain Derasar, North: Margin space, South: public road.

Authorised Officer Date: 03.08.2024 Place: Pethapur Bank of India

indianexpress.com

केनरा बैंक 📣 Canara Bank ि सिडिकेट Syndicate

Canara Bank Jamnagar, KV Road Branch Anjara Chambers, 1st Floor, K.V. Road, Jamnagar - 361 001

Authorised Officer, Canara Bank

SYMBOLIC POSSESSION NOTICE

Whereas The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 16.05.2024 calling upon the Mr. Bipinbhai B. Sanghavi (Borrower) to repay the amount mentioned in the notice, being as on 30.04.2024, amounts to Rs. 1,48,935.89/- (Rupees One Lakh Forty Eight Thousand Nine Hundred Thirty Five and Paisa Eighty Nine Only) plus further Interest and charges thereon from 01.05.2024 in the loan Account, within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 1st day of August of the year 2024.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the Public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Jamnagar, K.V. Road Branch for an amount of as on 30.04.2024, amounts to Rs. 1,48,935.89/- (Rupees One Lakh Forty Eight Thousand Nine Hundred Thirty Five and Paisa Eighty Nine Only) plus further Interest and charges thereon from 01.05.2024 in the loan Account.

Description of the Immovable Property

All the Piece and Parcel of Property bearing at Dist. Taluka Jamnagar, Nr. Mohannagar, JADAT.P. Scheme 1, F.P. No. 66, EWS/17-703, Flat No. 703, 7th Floor, as per the Allotment Order of Jamnagar Area Development Authority (JADA), as per the Pradhan Mantri Gruh Awas Yojana EWS Scheme, Bounded as follows:

North: Block 16 East: F.P. No. 54-2 West: Flat 702 South: Flat 704

Date: 01.08.2024, Place: Jamnagar

voting ('e-voting") process:-

SCANPOINT GEOMATICS LIMITED

Regd. Office: D-1016-1021, 10th Floor, Swati Clover, Shilaj Circle, S.P. Ring Road, Shilaj, Daskroi, A'bad-380059. CIN:L22219GJ1992PLC017073 Phone: 079-46023912 | e-mail: cs@sgligis.com | website: www.sgligis.com

Notice of Postal Ballot

Members are hereby informed that pursuant to the provisions of Section 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended (the "Act"), read together with the Companies (Management and Administration Rules, 2014, as amended (the "Management Rules"), General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022, and 09/2023 dated September 25, 2023, issued by the Ministry of Corporate Affairs, Government of India (the "MCA Circulars"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the *LODR Regulations) and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the approval of members of Scanpoint Geomatics Limited (the "Company") is sought for the following ordinary and special resolution(s) by way of remote e

| Sr. No. | Business | Special Resolution |
|------------|--|--------------------|
| 1. | Increase in Authorised Share Capital of the Company and Alteration of Capital Clause of Memorandum of Association of the Company | Ordinary |
| 2. | Appointment of Mrs. Seema Chandresh Vithlani (DIN:- 06921003) as an Independent Woman Director of the Company | Special |
| 3. | Amendment in object clause of the memorandum of association of the company | Special |
| 4. | Approval of Change of name of company from Scanpoint Geomatics Limited to SGL Resources Limited. | Special |

Pursuant to the MCA circulars, the Company has completed the dispatch of electronic copies of the Postal Ballot Notice along with the explanatory statement on Monday, August 05, 2024, through electronic mode to those Members whose email addresses are registered with the Company/depository participant(s) as on August 02, 2024 (Cut-off Date").

The said Notice is also available on the website of the Company: www.sgligis.com, the relevant section of the website of BSE Limited ("BSE"): www.bseindia.com on the website of National Securities Depository Limiter ("NSDL") www.evoting.nsdl.com.

In accordance of the provisions of the MCA circulars, Members can vote only through e-voting process. The voting rights of the Members shall be reckoned on the basis of the equity shares of the Company held by them as on the Cut-off Date. Any person who is not a shareholder of the Company as on the Cut-off Date shall treat the Postal Ballot Notice for information purposes only.

The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") for the purpose of providing e-voting facility to all its Members. The e-voting facility will be available during the following period:-

Commencement of e-voting period 09:00 a.m. IST on Tuesday, August 06, 2024 05:00 p.m. IST on Wednesday, September 04, 2024 Conclusion of e-voting period Cut-off date for E-voting Friday, August 02, 2024

Remote e-Voting will be blocked by NSDL immediately thereafter and will not be allowed beyond the said date and time.

The Board of Directors has appointed Mr. Ankit Thakrar (Membership No. F11762, COP No. 16611), Company Secretaries to act as the Scrutiniser to scrutinise the e-voting process in a fair and transparent manner.

The Scrutinizer will submit his report, after the completion of scrutiny, to the company secretary of the company. The results of e-voting will be announced on or before Friday, September 06, 2024 and will be displayed on the Company's website at www.sgligis.com and will also be communicated to the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call at 022 - 4886 7000 or send a

request at evoting@nsdl.com. All grievances connected with the facility of voting by electronic means may be addressed to Ms. Pallavi Mhatre, Senior Manager, National Securities Depository

Limited at the designated mail evoting@nsdl.com or call on 022-24994890 Date: August 5, 2024 By Order of the Board

Place : Ahmedabad For Scanpoint Geomatics Limited Komal Peshwani Company Secretary and Compliance Officer

Membership No: A63874



I choose substance over sensation.

Inform your opinion with credible journalism.

The Indian Express. For the Indian Intelligent.

The Indian Express.

For the Indian Intelligent.



financialexp.epapr.in

Ahmedabad